

EDUMATERIALS

સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8, સત્ર: 1

પ્રકરણ - 3 ભારતનું બંધારણ

1.ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે ?

(A) મૂળભૂત હકોથી

(C) મૂળભૂત ફરજોથી

(B) આમુખથી

(D) સ્વરાજ્યના દસ્તાવેજથી

2.ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે ?

(A) 35 કે તેથી વધુ વર્ષની

(C) 21 કે તેથી વધુ વર્ષની

(B) 25 કે તેથી વધુ વર્ષની

(D) 18 કે તેથી વધુ વર્ષની

3.આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે ?

(A) બે

(C) પાંચ

(B) છ

(D) ચાર

4.કયા દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો ?

(A) 26 જાન્યુઆરીને

(C) 15 ઓગસ્ટને

(B) 26 ડિસેમ્બરને

(D) 2 જાન્યુઆરીને

5.બંધારણ કઈ તારીખે અમલમાં આવ્યું ?

(A) 26/02/1950

(C) 15/08/1947

(B) 26/01/1950

(D) 26/09/1949

6.બંધારણને બંધારણસભાએ કઈ તારીખે સંમતિ આપી ?

(A) 26/02/1950

(C) 15/08/1947

(B) 26/11/1949

(D) 26/01/1950

7. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ભારતીય 'બંધારણનો અંતરાત્મા' કોને કહ્યો છે ?

- (A) બંધારણીય ઈલાજોના હકને (C) સ્વરાજ્યના દસ્તાવેજને
(B) આમુખને (D) મૂળભૂત ફરજોને

8. બંધારણસભાના અધ્યક્ષપણે કોને ચૂંટવામાં આવ્યા ?

- (A) ડૉ. રાધાકૃષ્ણનને (C) ડૉ. કનૈયાલાલ મુન્શીને
(B) ડૉ. રાજેન્દ્રપ્રસાદને (D) ડૉ. આંબેડકરને

9. કોઈ દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે, તેને કેવો દેશ કહેવાય ?

- (A) સાંપ્રદાયિક દેશ (C) પ્રજાસત્તાક દેશ
(B) લોકશાહી દેશ (D) બિનસાંપ્રદાયિક દેશ

10. 26મી જાન્યુઆરીના દિવસને આમાંથી કયા નામે ઓળખવામાં આવતો નથી ?

- (A) પ્રજાસત્તાકદિન (C) સ્વાતંત્ર્યદિન
(B) બંધારણદિન (D) ગણતંત્રદિન

11. કાયદો બનાવવા અને બન્ને પ્રકારની સરકારની કામગીરી વહેંચવા માટે વિષયોની કેટલી યાદી બનાવવામાં આવી છે ?

- (A) 2 (C) 3
(B) 4 (D) 5

12. “લોકોનું, લોકો માટે અને લોકોથી ચાલતું શાસન એટલે લોકશાહી.” આ ઐતિહાસિક વાક્ય સૌપ્રથમ કોણ બોલ્યું હતું ?

- (A) ચર્ચિલ (C) રૂઝવેલ્ટ
(B) ઓબામા (D) અબ્રાહમ લિંકન

13. બંધારણસભાની ખરડા સમિતિ કોના અધ્યક્ષપદે રચવામાં આવી હતી ?

(A) ડૉ. બાબા સાહેબ આંબેડકર

(C) સરદાર પટેલ

(B) ડૉ. રાજેન્દ્રપ્રસાદ

(D) જવાહરલાલ નહેરુ

14. હું એક સંઘરાજ્ય છું, મને ઓળખો.

(A) ચીન

(C) રશિયા

(B) ભારત

(D) જર્મની

15. આમાંથી બંધારણસભાનાં સ્ત્રી-સભ્ય કોણ હતાં ?

(A) શ્રીમતી એની બેસન્ટ

(C) શ્રીમતી ઈન્દિરા ગાંધી

(B) શ્રીમતી કમલાદેવી પંડિત

(D) સરોજિની નાયડુ

16. બંધારણસભામાં ઍંગ્લો-ઇન્ડિયનોનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

(A) એચ. પી. મોદીએ

(C) ફ્રેન્ક એન્થોનીએ

(B) રૂબિન ડેવિડે

(D) જ્યોર્જ થોમસે

17. બંધારણસભામાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

(A) જમશેદજી તાતાએ

(C) રતન તાતાએ

(B) એચ. પી. મોદીએ

(D) જે. દાસ ગુપ્તાએ

18. સરકારનાં અંગો કેટલા છે ?

(A) 4

(C) 5

(B) 3

(D) 6

19. બંધારણસભાએ તેની કામગીરી ક્યારે શરૂ કરી ?

(A) 9 ડિસેમ્બર, 1945

(C) 9 ડિસેમ્બર, 1946

(B) 20 ડિસેમ્બર, 1946

(D) 9 નવેમ્બર, 1946

20. હું દેશનો બંધારણીય વડો છું, મને ઓળખો.

(A) રાજ્યપાલ

(C) વડાપ્રધાન

(B) રાષ્ટ્રપતિ

(D) મુખ્યમંત્રી

EDUMATERIALS

.....

સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8, સત્ર: 1
પ્રકરણ - 3 ભારતનું બંધારણ

(1) B
(2) D
(3) C
(4) A
(5) B
(6) B
(7) A

(8) B
(9) D
(10) C
(11) C
(12) D
(13) A
(14) B

(15) D
(16) C
(17) B
(18) B
(19) C
(20) B